

મુખ્ય કચેરી: ઉદ્યોગભવન, બ્લોક નં ૧, નવમો માળ, સેક્ટર-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૧

ફોન: (૦૭૯) ૨૩૨૪૩૮૪૭, ૨૩૨૪૭૩૬૬, ૨૩૨૪૦૨૫૩, ફેક્સ: (૦૭૯) ૨૩૨૫૬૬૭૯

[www.ced.gujarat.gov.in](http://www.ced.gujarat.gov.in) Email: [cor-ced@gujarat.gov.in](mailto:cor-ced@gujarat.gov.in)

શું આપ જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રમાં ઉદ્યોગ સ્થાપી સ્વનિર્ભર થવા માંગો છો ? હા... તો



કેવી રીતે સ્થાપવો ?

કઈ કઈ મદદ અને સવલતો  
ઉપલબ્ધ છે ?  
ઉદ્યોગનું સફળ સંચાલન  
કેવી રીતે કરવું ?



જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રમાં ધંધો શરૂ કરવા માટે

જરૂરી જ્ઞાન, વ્યવસ્થિત માહિતી અને વ્યવહારુ માર્ગદર્શન

“હાઉ ટુ સ્ટાર્ટ ઓન લાઇન બિઝનેસ ઓન જેમ્સ એન્ડ જવેલરી” તાલીમ કાર્યક્રમમાં જોડાઓ...

જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્ર એ રાષ્ટ્રીય અર્થતંત્રનો એક સંકલિત ભાગ છે. ભારત વિશ્વ બજારમાં ૮૦% હિસ્સા સાથે વિશ્વનો સૌથી મોટો ડાયમંડ પ્રોસેસીંગ દેશ છે. ગ્રાહકની વધતી ખરીદ શક્તિનાં કારણેથી આ ક્ષેત્ર માં ઉદ્યમીઓ માટે ઉજળી ધંધાકીય તકો છે. આ ક્ષેત્ર માં ૨૧ મી સદીમાં મહિલાઓ માટે ઉદ્યોગ ધંધાની તકો વધી રહી છે. જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રમાં ઉદ્યોગ ધંધો સ્થાપવા માંગતા યુવાનો, ભાઈઓ-બહેનો માટે સીઈડી દ્વારા જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા તાલીમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

**તાલીમનો સમયગાળો:-** (તા:૨૭/૯/૨૦૧૬ થી ૨૮/૯/૨૦૧૬) બે દિવસીય સવારે ૧૦:૦૦ થી સાંજનાં ૫:૩૦ જે બિન નિવાસી અને સ્વખર્ચનો રહેશે.

**કાર્યક્રમમાં પસંદ થયેલ તાલીમાર્થીની ફી** જનરલ જ્ઞાતિ/ઓ.બી.સી/લઘુમતીના ભાઈઓ માટે રૂ. ૫૦૦/-, જનરલ જ્ઞાતિ/ઓ.બી.સીની બહેનો, અનુસુચિત જાતિ/જનજાતિના ભાઈઓ/બહેનો તથા વિકલાંગ, માજી સૈનિક તથા ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રૂ. ૩૦૦/- (જેમાં રીફ્રેશમેન્ટ ખર્ચનો સામાવેશ થયેલ છે) (જનરલ સિવાયના તાલીમાર્થીએ જ્ઞાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, વિદ્યાર્થીઓએ કોલેજનું પ્રમાણપત્ર અથવા ૨૦૧૬-૧૭નું કોલેજનું ઓળખપત્રની નકલ બીડવાની રહેશે. ◆ ઇચ્છુક ઉમેદવારોએ નીચેના સરનામેથી ફોર્મ મેળવી જરૂરી દાખલાઓ સાથે ભરી જાહેરાતની તારીખથી દિન સાતમાં તે જ સ્થળે જરૂરી ફી સાથે પરત આપવાનું રહેશે. ◆ આ તાલીમી કાર્યક્રમમાં ૪૦ તાલીમાર્થીઓને પ્રવેશ વહેલાં તે પહેલાંનાં ધોરણે પસંદગી કરવામાં આવશે. ◆ અરજી ફોર્મ [www.ced.gujarat.gov.in](http://www.ced.gujarat.gov.in) ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

તાલીમનું સ્થળ, અરજી ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સરનામું : (ઓફિસ સમય દરમિયાન)

સીઈડી નરોડા કેમ્પસ, પ્લોટ નં.૮૭-૮૮, સમ્રાટ નમકીન ની બાજુમાં, રીલાયન્સ રોડ, જીઆઈડીસી નરોડા, અમદાવાદ.

મો.૯૯૭૪૭૪૯૦૨૪, ફોન: ૦૭૯-૨૨૮૧૪૧૩૭, [cor-ced@gujarat.gov.in](mailto:cor-ced@gujarat.gov.in)